

૧૮માં વાર્ષિક પદવીદાન સમારંભનું ફોર્મ ભરવા અંગે વિદ્યાર્થીઓ માટે
અગત્યની સૂચના

- ❖ ૧૮માં વાર્ષિક પદવીદાન સમારંભમાં લાયક ઠરતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ http://45.116.204.50/convocation/Student_Convocation.aspx લિન્ક દ્વારા ભરવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા વિદ્યાર્થીઓએ પદવીદાન સમારંભની ફી રૂ.500/- QR Code/બેન્ક ડિટેલ્સ મારફતે ઓનલાઇન ભરવાની રહેશે. વિદ્યાર્થીના રજિસ્ટ્રેશન નંબર દ્વારા ફોર્મ ઓપન કરી શકાશે. ફોર્મની વિગત અને જરૂરી ફી રૂ. ૫૦૦/- ભર્યા બાદ જ ફોર્મ સબમિટ કરી શકાશે.


Bank Name : State Bank of India,

Bank Account No. : 32135853186

Account Holder Name : Registrar, Anand

Agricultural University, Anand

Bank IFSC Code : SBIN0000313



- ❖ જો કોઈ વિદ્યાર્થી એક કરતાં વધારે ડીગ્રી મેળવવા લાયક ઠરતો હોય તો તેને દરેક ડીગ્રી માટે અલગ અલગ ફોર્મ તેમજ ફી રૂ. ૫૦૦/- ભરવાની રહેશે. અનુસ્નાતક કક્ષાના જે વિદ્યાર્થીઓએ તા.૩૦/૧૧/૨૦૨૧ સુધીમાં થીસીસ સબમિટ કરાવેલ હોય તેવા વિદ્યાર્થીઓ જે ડિગ્રી પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી શકશે.
- ❖ ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા બાદ તે ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી દરેક પાના ઉપર સહી કરી સદર ઓનલાઈન ફોર્મ સાથે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ ટ્રાન્સ્ક્રીપ્ટ તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ નોટિફિકેશનની સ્વપ્રમાણિત નકલ સામેલ કરી કુલસચિવશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદને મોકલી આપવાની રહેશે. તથા વિદ્યાર્થીએ ફોર્મ મોકલતા પહેલા પોતાના ફોટોગ્રાફ પાછળ પોતાનું પૂરું નામ, ડીગ્રી અને ફેકલ્ટી લખવાની રહેશે.
- ❖ પદવીદાન સમારંભ અંગેના ફોર્મમાં પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો વ્યવસ્થિત ફોટોગ્રાફ ચોટાડવાનો રહેશે (પોતાની જાતે લીધેલ તેમજ મોડલિંગ ફોટોગ્રાફ ચોટાડવો નહીં.).
- ❖ ૧૮મો પદવીદાન સમારંભ ઓનલાઈન યોજનાર છે જેથી પદવી મેળવનાર વિદ્યાર્થીઓએ રૂબરૂ આવવાનું રહેશે નહીં. પદવીદાન સમારંભ નિહાળવા માટેની લિંક યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેથી ઓનલાઇન જોડાઈ શકાશે
- ❖ પદવીદાન સમારંભ પૂર્ણ થયા બાદ આપના પદવી પ્રમાણપત્ર આપના સરનામે રજી. પોસ્ટ દ્વારા પંહોચતા કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.
- ❖ ૧૮માં પદવીદાન સમારંભમાં ડિગ્રી મેળવનાર ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓ સિવાય તમામ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ પદવીદાન સમારંભની લિન્ક દ્વારા ઓનલાઇન જ જોડાવાનું રહેશે.

કુલસચિવ